

## નોટીસ

આથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની જુદી-જુદી વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના નવા સત્રથી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું વિચારણા હેઠળ છે. આથી યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરવા આવતાં સમયે વિદ્યાર્થીએ (Covid-19)ના સંક્રમણ અટકાવવા માટે નીચેની સુચનાઓનું પાલન કરવા જણાવવામાં આવે છે.

- ૧) આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઇલમાં ફરજિયાત ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે.
- ૨) યુનિ. કેમ્પસ ખાતે રૂબરૂ હાજર થવા સમયે વિદ્યાર્થીએ Covid-19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધેલ હોવો જોઈએ તે બાબતનું સર્ટીફિકેટ બાહેધરી પત્રક સાથે બીડવાનું રહેશે.
- ૩) સરકારશ્રી દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ Covid-19ની ગાઈડલાઇનનું ચુસ્ત પલો પાલન કરવાનું રહેશે.
- ૪) વિદ્યાર્થીઓએ હાજર થતી વખતે નીચે મુજબની વાલીની સંમતિ લાવવાની રહેશે.

### -: સંમતિ પત્ર :-

વિદ્યાર્થીનું નામ: \_\_\_\_\_  
રજીસ્ટ્રેશન નંબર: \_\_\_\_\_  
ઇ-મેઇલ: \_\_\_\_\_  
મો.નં. \_\_\_\_\_  
વાલીનું નામ: \_\_\_\_\_  
સરનામું: \_\_\_\_\_  
મો.નં. \_\_\_\_\_  
તારીખ : \_\_\_\_\_  
ઇમેઇલ: \_\_\_\_\_

પ્રતિ,

આચાર્યશ્રી,

વિષય: મારા પુત્ર/પુત્રીને કોલેજમાં શૈક્ષણિક કાર્ય માટે મોકલવા અંગે સંમતિ પત્ર આપવા બાબત...

માનનીય સાહેબશ્રી,

સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ માર્ગદર્શિકા (૧)નું પાલન કરવાની શરતે વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય તા..... શરૂ થનાર છે. મારા પુત્ર/પુત્રી.....ને કોલેજમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવાની આથી હું સંમતિ આપું છું. મારા પુત્ર/પુત્રી દ્વારા સરકારશ્રીની માર્ગદર્શિકા (૧) તથા કોવિડ-૧૯ અંગેની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે તેની હું બાહેધરી આપું છું. મારા પરિવારમાંકોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે કે મારૂ નિવાસ સ્થાન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતું હશે તો મારા પુત્ર/પુત્રીને સંસ્થામાં શૈક્ષણિક કાર્ય માટે પ્રત્યક્ષ નહીં મોકલું તેની હું ખાતરી આપું છું. સરકારશ્રીના વખતોવખતની કોવિડ-૧૯ની સૂચનાઓ તથા ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.

અમારી જાણ મુજબ મારો પુત્ર/પુત્રી સંપૂર્ણ સ્વસ્થ છે. અને મારી પુત્ર/પુત્રીએ કોરોના રસીકરણનો ડોઝ ૧  / ૨  તા.....(રસીકરણનું સર્ટીફિકેટ સામેલ) લીધેલ છે. ભવિષ્યમાં જો મારો પુત્ર/પુત્રી કોવિડ-૧૯થી સંક્રમિત થશે તો તેની જવાબદારી સંસ્થાની રહેશે નહીં.

આપનો વિશ્વાસુ

વિદ્યાર્થીની સહી

વાલીની સહી અને નામ